

## ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

સુધારા જાહેરાત (જાહેરાત ક્રમાંક: ૧૬૭/ ૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સચિવાલયના શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગર હસ્તકના વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ સંયુક્ત જાહેરાત ક્રમાંક: ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ પ્રસિદ્ધ કરી લાયક ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. જેમાં ઉમેદવારોને ઓન-લાઇન અરજીપત્રકો રજીસ્ટર્ડ કરવા માટેની છેલ્લી તા. ૧૧/૦૪/૨૦૧૯ નિયત કરવામાં આવેલ હતી. જે સંદર્ભે કેટલાક આર્થિક રીતે નબળા વર્ગના અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારો તરફથી નાણાંકીય વર્ષ - ૨૦૧૮-૨૦૧૯ ના વર્ષ માટેનું આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારોને નોન-કિમીલેયર પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી પડી રહેલ હોવાની મંડળને કરવામાં આવેલ ટેલિફોનિક રજુઆત અન્વયે ઓન-લાઇન અરજીપત્રકો રજીસ્ટર્ડ કરવા માટેની છેલ્લી તા. ૨૦/૦૪/૨૦૧૯ સુધી લંબાવવામાં હતી. જે સંદર્ભે પણ કેટલાક ઉમેદવારો તરફથી આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારોને નોન-કિમીલેયર પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી પડી રહેલ હોવાની ટેલિફોનિક રજુઆત કરવામાં આવેલ છે. જેથી અરજીપત્રક ભરવાની છેલ્લી તારીખ સુધીમાં પ્રમાણપત્રો ન મળવાના કારણે કેટલાક ઉમેદવારો અરજીપત્રક ભરવાથી વંચિત રહી જવાની સંભાવના રહેલ છે. તેથી અરજીપત્રકોના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા લંબાવવા માટે વિનંતી કરેલ છે. તેથી તેવા ઉમેદવારો પોતાનું અરજીપત્રક રજીસ્ટર્ડ કરી શકે તે માટે સમમર્યાદા લંબાવવી જરૂરી જણાયેલ છે.

ઉપરોક્ત બાબતેની ઉમેદવારોની રજુઆત ધ્યાને લઈ આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારો નોન-કિમીલેયર પ્રમાણપત્ર મેળવીને ઉમેદવારી નોંધાવી શકે તે માટે ઓન-લાઇન રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા તા. ૦૬/૦૫/૨૦૧૯ સુધી લંબાવવામાં આવે છે. તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ભરવા માટેની તા. ૧૦/૦૫/૨૦૧૯ સુધી લંબાવવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

નોંધ (તમામ ઉમેદવારો માટે)

- (૧) આ સુધારા જાહેરાત અન્વયે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત માટે **CUT OFF DATE** અગાઉ તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબની તા. ૧૧/૦૪/૨૦૧૯ રહેશે. જ્યારે આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પ્રમાણપત્ર તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે નોન-કમિલેયર પ્રમાણપત્ર માટેની **CUT OFF DATE** તા. ૦૬/૦૫/૨૦૧૯ રહેશે.
- (૨) આ સુધારા જાહેરાત થી OJAS પર ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા હવે તા. ૦૬/૦૫/૨૦૧૯ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે.
- (૩) ઉમેદવારો માટેની અન્ય શરતો મૂળ જાહેરાતોમાં દર્શાવ્યા મુજબની યથાવત રહેશે.

તારીખ :- ૨૦/૦૪/૨૦૧૯

સ્થળ :- ગાંધીનગર

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,  
ગાંધીનગર